

CIN NO.: L65999GJ2017PLC098565

#### IBL FINANCE LIMITED

(Formerly Known as IBL Finance Private Limited)

Corp. Office: - 2002, The Junomoneta Tower, Opp. Pal RTO, Nr. Rajhans Cinema, Pal, Surat-395009, Gujarat, India.

**Date:** 30/07/2025

To, Listing Compliance Department National Stock Exchange of India Limited Exchange Plaza, Bandra Kurla Complex Bandra East, Mumbai - 400051.

Dear Sir/Madam,

Newspaper publication of Notice of 8th Annual General Meeting of the Company Sub:

Ref: **IBL Finance Limited (Symbol: IBLFL)** 

Dear Sir/ Madam,

Pursuant to the provisions of Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a Newspaper copy of Notice of the 8th Annual General Meeting ("AGM") of the Company to be held on August 22, 2025, Book closure/cut-off date and evoting schedule which was published in "Free Press" (English) and "Lokmitra" (Gujarati) newspaper dated 30th July, 2025.

Please take the above on record and disseminate the same on your website.

Thanking you

For IBL Finance Limited

Dilipbhai Chauhan **Company Secretary and Compliance Officer** Membership no.: A63390

Place: Surat

Reg. Office: 151, 1st Floor, Silverstone Arcade, Singanpore-Causeway Road, Surat-395004, Gujarat, India. **4** 9328116900

## Collapsed after doing yoga

52-year-old middle-aged man developed chest pain while descending stairs, died during 2 hours of treatment



incident in Rajkot has been captured on CCTV. After doing yoga at a yoga center, a middleaged man who was sitting on a chair suddenly collapsed. He was rushed to the hospital in an unconscious state but was declared dead. It can be clearly seen in the CCTV that the old man was doing yoga and was Rajendrasinh Gurji (aged 52), descending the steps and he sat originally from Chhattisgarh, had down on the chair below.

At this time, he must have been feeling some pain in his Chowk in the city in the morning. heart, so he was found putting his hand on his chest and suddenly collapsed a minute around 8 am and suddenly felt later. It is worth mentioning here a pain in his chest, so he sat

Rajkot, Another heart attack that two days ago, a migrant youth collapsed while acting suspiciously in the Metoda area of Rajkot, which was also caught

> After doing yoga, he came down the stairs and suddenly collapsed. CCTV footage of another heart attack incident has surfaced in Rajkot city today. gone to do yoga at the Om Wellness Center at Rajnagar After doing yoga, he came down the stairs after doing yoga

down on a chair for some time. At this time, after about a minute, he suddenly collapsed from the chair where he was sitting. He was shifted to the hospital in an unconscious state but he died. The initial report revealed that the deceased Praudh had suffered a heart attack. The incident was reported to Malviyanagar police by the staff of the Civil Chowki. The police reached the hospital and shifted the body for postmortem and took necessary paperwork to find out the exact cause of death. The initial report of the postmortem revealed that the deceased Praudh had suffered a heart attack. It is worth mentioning that Rajendrasinh Gurji (aged 52) had gone to the Yoga Center in the morning from where he was shifted to the Civil Hospital via 108 at around 8 am. However, he died at 10 am during a short treatment. The elderly man died during a short treatment.

It can be clearly seen in the CCTV footage of Om Wellness Center that at 8:00 and 9:00, Rajendrasinh Gurji (aged 52) folds one hand over his chest and holds a bag in the other hand as he descends the stairs and sits down in a chair near the stairs.

### E3-Iran nuclear talks: Slim chances for a second deal

Friday morning Iran resumed nuclear talks with Britain, France, and Germany (also called Europe's E3) which are parties to its 2015 Joint Comprehensive Plan of Action (JCPOA), which had codified a 3.7 per cent limit for Iran's uranium enrichment and a waiver of sanctions on Iran. But whether resumption of E3-Iran talks can facilitate revival of US-Iran talks leading to crafting a JCPOA 2.0 has serious limits so far. Prima facie, this second round of E3-Iran talks at Iran's Consulate in Istanbul continuing for four hours on Friday morning seems like a good sign for a start. The Iranian side was represented by Deputy Foreign Minister Kazem Gharibabadi, who said they had a frank, serious, and detailed discussion and "agreed that consultations on this matter will continue". Only that the JCPOA is due to expire in less than three months on October 18. The fundamental leverage that E3 has is to 'snap back' sanctions under the JCPOA, but it must start any such effort at least 30 days in advance, which leaves it with even less time. Then beyond the US, they will also have to deal with China and Russia.

## July 30th - A Day to Honor International Friendship We cannot leave our whole when a friend made a change



**Vinod Chandrashekhar Dixit** Free-lance Journalist, Writer & Cartoonist

(dixitpatrakar@yahoo.in)

International Friendship Day is celebrated on 30th July as per the resolution adopted by United Nations in 2011. It was decided to forge a strong bond of friendship among people of various countries irrespective of their race, colour, gender, religion, ethnicity and other such factors. A bond that is Perhaps, boundless. could be friendship summarized thus. The virtue of friendship has been appreciated by one and all over the world. Friendship is a faithful and loyal relationship between two or more person

The United Nations

incubator of jihadist terrorism.

It has systemically used

terrorism as an instrument of

foreign policy and continues to

harbour, finance, and protects

internationally sanctioned

terrorist organizations like

Lashkar-e-Taiba (LeT) and

at the helm of the committee

tasked with monitoring and

sanctioning the Taliban, the

UNSC has signalled an erosion

of its foundational principles.

It has, in effect, made a

mockery of its own anti-terror

framework and compromised

the very credibility it is

Committee, created under

UNSC Resolution 1988, was

designed with a critical

mission, that is to oversee and

implement measures such as

asset freezes, travel bans,

and arms embargoes on

individuals and entities

associated with the terror

sanctions aim to pressure

Taliban leaders and affiliates

into abandoning terrorism,

severing suspected links with

international terror networks

like Al-Qaeda, and embracing

peaceful political processes.

The committee's role is

essential in maintaining the

fragile global consensus

of Pakistan as chair subverts

this mission. It is akin to giving

a fox the keys to the

henhouse. Rather than being

a neutral enforcer of

sanctions, Pakistan has a

direct and longstanding

relationship with the very

actors the committee is meant

to restrain. The contradiction

is so stark that it calls into

question the sincerity of the

However, the appointment

against jihadist extremism.

organizations.

The 1988 Sanctions

supposed to uphold.

By placing such a country

Jaish-e-Mohammad (JeM).

life alone and need a faithful relationship to someone to live happily called friends. Friendship is universal, and with social media so present nowadays its hard not to stay close and up to date with those special people, even if they don't live in the same town anymore. Everyone needs a good and loyal friend to share bad or good life events, enjoy happy moments and share unbearable events of the life. Emphasizing on the importance of friendship, the great ancient Greek Philosopher and scientist exclaimed, "Man is by nature a social animal; an individual who is unsocial naturally and not accidentally is either beneath our notice or more than human. Society is something that precedes the individual. Anyone who either cannot lead the common life or is so self-sufficient as not to need to, and therefore does not partake of society, is either a beast or a god. '

There are people to whom friendship is everything. Without a friend, life becomes unbearable for them. A saviour in troubled times, a friend in need becomes an invaluable asset. It is a nice experience to cherish living anywhere in the world. memories of those occasions of God. With the world Ahmedabad - 380 015)

in one's life with a timely act. Devoting a day to such nice people in one's life is an idea worth celebrating. And, many people have already embraced the idea. According to the great Roman Statesman Cicero "Friendship increases happiness and diminishes misery by doubling our joy and dividing our grief". The main purpose of

International Friendship Day is

to promote the concept of

friendship across different backgrounds and cultures in order to promote peace all over the world. It is also for reminding the general public of the importance of maintaining friendship and making new friends for improving\* the overall wellbeing of a person. The International Day of Friendship is an important opportunity to confront misunderstandings and distrust that underlie so many of the tensions and conflicts in today's world. It is a reminder that human solidarity

is essential to promoting lasting peace and fostering sustainable development. Getting a best friend in the life is very hard for everyone and if one gets it, he/she is really bestowed with the true love

thanks to the transformation brought about by information technology, Indians too have joined the bandwagon of worshippers of friendship through the net and other means. Friendship Day is all about celebrating the bond of friendship. Connections are like plants which you need to take care of. You need to constantly nourish your connections with different individuals in order to maintain the friendship or build it.

Friendship Day is all about celebrating the bond of friendship. It is an occasion to turn the pages of life and reminisce the wonderful moments that you have spent with your pals in the school, college or workplace. Friendship between different people from different countries and with different cultures can inspire peace efforts and assist in building bridges between communities. Friendship is

important because it helps break down barriers and connect people with diverse cultures and backgrounds. It even plays an important role in promoting peace in different cultures. (B-15 Jyoti-Kalash Society, Jodhpur Tekra, Satellite,

## Beyond blame game: Thailand, Cambodia must understand their shared past

between Cambodia and Thailand that erupted on Thursday, July 24, along various locations continues to worsen as it entered its fourth day on Sunday, July 27. Each side claims the other launched fresh artillery attacks across contested border areas, despite US President Donald Trump's Saturday claim that leaders of both countries had agreed to work towards a ceasefire.

While Cambodia said it fully endorsed Trump's call for an immediate ceasefire, Thailand expressed gratitude to the US President but opined that talks with Cambodia were not possible at this stage munitions and artillery, as because Cambodia continued to target Thai civilians—a claim Phnom Penh vehemently denied.

The Blame Game

Both sides continue to blame each other for firing the first shot on Thursday and for military actions that have exacerbated the border fight, engulfing new areas and causing severe collateral damage.

Cambodia's Defence Ministry claimed on July 27 that Thailand shelled and launched fresh ground assaults at several points along the border, including firing heavy artillery at historic temple complexes. Contrarily, the Thai army claimed Cambodian forces had fired shots into several areas on resign over ethical issues Sunday, including civilian homes, and alleged that the Cambodian army was mobilising launchers.



Thailand also accused Cambodia of launching "armed attacks" on its civilians, while Cambodia cited Thailand's deployment of F-16 jets and tanks, and its use of cluster examples of aggression.

As I write this piece, what began as skirmishes along the border threatens to escalate into an all-out war between the two Southeast Asian neighbors, who have a long history of disputed border claims.

Friends Turned Foes

The latest dispute has been exacerbated by a feud between two supposedly old friends—Hun Sen, the authoritarian ruler who handed power in Cambodia to his son Hun Manet in 2023, and Thailand's former populist leader Thaksin Shinawatra, whose daughter Paetongtarn Shinawatra became prime minister in 2024 but had to related to the border dispute.

Both Thaksin and Hun Sen remain highly influential in long-range their countries. Once the disputed border. considered close friends, they

PHYSICAL POSSESSION NOTICE

are now embroiled in a bitter dispute, trading insults on social media.

The public rift between Thaksin Shinawatra and his longtime friend Hun Sen, Cambodia's de facto leader, has further fueled their future trajectory remains unknown.

Collateral Damage

Thailand and Cambodia share a long, complex history that predates modern borders. The rigid lines of nation-states cannot fully account for the between these two Southeast Asian neighbours.

Four days into the deadliest conflict in the last 14 years between the two countries, the border clashes, which began on Thursday with violence over contested territory near Prasat Ta Muen Thom—an ancient temple have already claimed at least 34 lives and displaced more than two hundred thousand people. As I conclude this piece, clashes have escalated to at least 12 locations along

Casualties: According to

sources, at least 13 people have been confirmed killed so far-8 civilians and 5 soldiers—with more than 71 wounded. In Thailand, the army has reported a total of 21 deaths so far, including 14 civilians (children among them) and 7 armed forces personnel. Additionally, at least 29 Thai soldiers and 30 civilians have been wounded in Cambodian attacks.

Displacements: At least 138,000 people have been evacuated from Thai border regions, while over 50,000 have either fled or been evacuated in Cambodia.

The casualties and evacuations in this latest conflict have already exceeded countries' conflict, whose those from the previous clashes between 2008 and 2011.

The Centrifuge

The most recent tensions began in May when troops from Thailand and Cambodia briefly exchanged fire in a contested area, killing a deep civilisational ties Cambodian soldier and leading to retaliatory measures by both sides.

On Wednesday, July 23, the crisis worsened when five Thai soldiers were injured by a landmine—the second such incident in less than a week. Thailand alleged that landmines had been recently placed in the area—a claim Cambodia denies. The situation further deteriorated with Thailand recalling its ambassador to Cambodia and announcing it would expel Cambodia's envoy in Bangkok.

Why the Fighting? First, a Century-Old Dispute—Thailand and Cambodia have bickered for decades over un-demarcated points along their 817-km (508-mile) land border, leading to periodic tensions.

The contested claims stem from a 1907 map drawn under French colonial rule that separated Cambodia from Thailand. Cambodia has used this map as a reference to claim territory, while Thailand argues it is inaccurate.

The most prominent and violent conflicts have centered around the 1,000-year-old Preah Vihear temple, a major point of dispute.

In 1962, the International Court of Justice (ICJ) awarded sovereignty over the Preah Vihear temple area to Cambodia. However, tension escalated in 2008 after Cambodia attempted to list it as a UNESCO World Heritage site, leading to skirmishes over several years that caused

Security Council (UNSC) decision to appoint Pakistan as the chair of its Taliban Sanctions Committee is a staggering betrayal of its own counter terrorism mandate effectively turning a global watchdog into an enabler of the very forces it was meant to restrain. This development has not only raised eyebrows but also serious questions about the UNSC's commitment to fighting global terrorism. international community's documented The appointment is not merely commitment to eradicating international ironic, it is in fact profoundly terrorism especially at a time dangerous. Pakistan, far from when Pakistan's military Field being a neutral stakeholder in Marshal Asim Munir has counterterrorism experts and the fight against terror, has openly come across voicing long operated as the global

**How UNSC blew its credibility** 

in the fight against terrorism

support for the global designated organisations like Lashkar-e-Taiba (LeT) and Jaish-e-Mohamad (JeM). Both these terrorist organisations have a huge role in perpetrating terrorism not only against India but also globally. The recent Pahalgam terror attack is a testimony to the fact that Pakistan continues to brazenly brandish and perpetrate Pakistan's terrorism. reputation as a state sponsor of terrorism is neither speculative nor exaggerated. It is rooted in decades of

actions, intelligence findings, and firsthand accounts from security agencies around the world. Pakistan's Inter-Services Intelligence (ISI) agency has been the primary architect behind a complex web of terrorist groups that serve the country's strategic interests across South Asia and beyond. In India, Pakistan has consistently supported terror groups like LeT and JeM, responsible for some of the most horrific attacks in the region. LeT's role in the 2008 Mumbai attacks that claimed over 170 lives, including foreign nationals to the recent Pahalgam attack claiming 26 lives is a chilling testament to

Pakistan's continuous strategy of using terrorism as asymmetric warfare. JeM, likewise, carried out numerous attacks on Indian soil. From attacking the Indian Parliament in 2001 to the deadly Pulwama suicide bombing in 2019, JeM continues till date with its terror activities in Jammu and Kashmir. Both groups continue to operate openly in Pakistan, under various aliases and charitable guises, with complete state protection. In Afghanistan, Pakistan's

influence is even more brazen. The Taliban movement itself originated in the Pakistan, where its leadership council the socalled "Quetta Shura" was long headquartered. Pakistan provided the Taliban with training, arms, financial aid, and ideological guidance, facilitating their rise during the Afghan civil war and their resurgence following the US invasion in 2001. As the United States and its allies fought to stabilise Afghanistan, Pakistan played a duplicitous game. It positioned itself as a frontline partner in the War on Terror, receiving billions of dollars in military and economic aid.

#### **IBL FINANCE LIMITED**

CIN: L65999GJ2017PLC098565 Registered Office: Shop-151, Silver Stone Arcade, Nr. Kantheriya Hanuman Temple, OP-34/ABCD, FP-50, Singanpore, Causway Road, Surat, Gujarat, India, 395004 Website: www.iblfinance.in; Email: compliance@iblfinance.in; Phone No.: +91 93281 16900

#### NOTICE OF THE 8<sup>TH</sup> ANNUAL GENERAL MEETING OF THE COMPANY, **BOOK CLOSURE / CUT OFF DATE AND E-VOTING**

Notice is hereby given that the  $8^{
m th}$  Annual General Meeting (AGM) of IBL Finance Limited will be held on Friday, August 22, 2025 at 4:00 PM IST via Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM) in accordance with MCA Circular No. 09/2024 dated September 19, 2024 along with previous circulars (hereinafter collectively referred to as "MCA Circulars"), and related SEBI Circular dated October 03, 2024, to transact ordinary and special business as detailed in the AGM notice. The AGM Notice and Annual Report 2024-25 are being sent only through electronic mode to members whose email IDs are registered with the Company/Depositories as on Friday, July 25, 2025, and are available at www.iblfinance.in, www.nseindia.com and www.evoting.nsdl.com. Members who have not registered their email IDs can temporarily register them as per the procedure given in the AGM notice. Upon successful registration, members will receive the AGM documents and e-voting credentials.

The Register of Members and Share Transfer Books will remain closed from August 16, 2025 to August 22, 2025. Members holding shares as on cut-off date: August 15, 2025, can participate in remote e-voting and e-voting during the AGM. The remote e-voting will commence on 9:00 A.M. on Tuesday, August 19, 2025 and will end on 5:00 P.M. on Thursday, August 21, 2025. Members may note that: a) Once a vote is cast through remote e-voting module, it cannot be changed, b) E-voting facility will be available during the AGM and c) Members who voted via remote e-voting may attend the AGM but cannot vote again.

Members who acquire shares after dispatch of the notice and hold them as on August 15, 2025, may request login credentials by emailing evoting@nsdl.co.in or compliance@iblfinance.in. Existing NSDL users can use their current credentials. Forgotten passwords can be reset on www.evoting.nsdl.com. As per SEBI's circular dated December 9, 2020 on e-Voting facility provided by Listed Companies, individual shareholders in demat mode can vote through their demat accounts. Ensure mobile number and email are updated with the depository. Members may contact Mr. Dilipbhai Chauhan, Company Secretary and Compliance Officer of the Company at the registered office of the Company or may write an e-mail to compliance@iblfinance.in or may call on +91 9328116900 for any further clarification.

Members can attend and participate in the AGM through VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the AGM Notice. In case the shareholders/members have any queries or issues regarding participation in the AGM, you can write an email to evoting@nsdl.co.in or Call at: 1800 1020 990 and 1800 22 44 30. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

> For IBL Finance Limited Dilipbhai Chauhan

**Company Secretary and Compliance Officer** 

Place: Surat Date: July 30, 2025

The above-mentioned borrowers(s)/ guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: July 30, 2025 Authorised Officer

OICICIBank | Branch Office: ICICI Bank Ltd Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane (West)- 400604

The undersigned being the Authorised Officer of ICICI Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 and in exercise of the powers conferred under section 13 (12) R/w Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, (on underlying pool assigned to ICICI Bank by Dewan Housing Finance Ltd.) in relation to the enforcement of security in respect of a Housing Loan facility granted pursuant to a loan agreement entered into between DHFL and the borrower, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the belowmentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with

the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.							
Sr. No.		Description of Property/ Date of Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs.)	Name of Branch			
	Hardik Bharatbhai Solanki / Pujaben Hardikbhai Solanki- New ICICI Lan No. QZSUR00005013410- Old DHFL Lan No. 04100008551	Flat No. 406, 4th Floor, Building No. A, Harikrushna Residency, Near Railway Crossing, Block No. 338/B, Umra, Olpad, Surat- 394210. July 26, 2025	September 30, 2024 Rs. 12,17,100.76/-	Surat			
	Jagaram N Jat / Jamudevi Jagdiskumar Jat- New ICICI Lan No. QZBRD00005019465- Old DHFL Lan No. 01800008059	Flat No. A/404, 4th Floor, Wing A, Dharam- bhakti Residency, Opp Sai Swami Residency, Kim Main Road, Opp Swami Narayan Temple, Kudsad, Ramnagar, Block No. 799, Plot No. 21,22,23,24,25,26, Surat 394110. July 27, 2025	July 13, 2022 Rs. 13,60,117.00/-	Surat			

### પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ના અમલીકરણમાં જુલાઈ ૨૦૨૫ માટે ગુજરાત રાજ્ય ટોચના સ્થાન પર પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત ૧૨,૪૮૯ આવાસો મંજૂર કરવામાં આવ્યા

ગાંધીનગર એચ.ઓ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, પર્ટિક્ચુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં જુલાઈ ૨૦૨૫ માટે ટોચનું રાજ્ય બન્યું છે. પીએમ જનમન યોજનાના અમલીકરણ માટે દર મહિને સ્ટેટ રેંકિંગ જાહેર કરવામાં આવે છે, જેમાં જુલાઈ મહિનામાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે. આ દર્શાવે છે કે આદિજાતિના વિકાસ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર મજબૂત પ્રયાસો કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના ૧૮ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશમાં વસતા ૭૫ પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTG) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોનો સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૫ નવેમ્બર, કનેક્ટિવિટી, પાઇપ મારફતે પાણીનો ૨૦૨૩ના રોજ 'જનજાતીય ગૌરવ સપ્લાય, આરોગ્ય અને શિક્ષણની દિવસ' નિમિત્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશનનો પ્રારંભ કર્યો હતો. આ વિકાસ કેન્દ્રો તેમજ મલ્ટીપર્પઝ PVTG સમુદાયોની મહિલાઓ માટે મિશનનો ઉદ્દેશ સમયમર્યાદામાં ખાસ નબળા છે. આદિજાતિ જૂથો (PVTG)ને આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, પાણી, વીજળી, આજીવિકા અને કનેક્ટિવિટી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડીને તેમનું તે મુજબ સુવિધાઓના લક્ષ્યાંક નક્કી સામાજિક ઉત્થાન કરવાનો છે. આદિજાતિ જૂથો (PVTG) વસે છે, જેમાં કાથોડી, કોટવાળિયા, પઢાર,



પીએમ જનમન હેઠળ રાજ્યમાં ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ના પ૨૦૦ ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી, ૩૭ મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા

આરોગ્ય, શિક્ષણ તેમજ આજીવિકામાં અંતરને દૂર કરીને ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાનો પીએમ જનમન યોજનાનો ઉદ્દેશ

થાય છે. આવા જૂથોને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

ગુજરાતે કરેલી પ્રગતિ

પીએમ જનમન મિશન હેઠળ ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTGs) ને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવામાં આવે છે. જેમાં આવાસ, રોડ-રસ્તાની સુવિધાઓ, નવીન આંગણવાડીઓનું નિર્માણ, વીજળીકરણ, મોબાઈલ ટાવરનું ઇન્સ્ટોલેશન, વન ધન નિશ્ચિત સેન્ટરોની સ્થાપનાનો સમાવેશ થાય આગામી સમયમાં

> આ મિશન હેઠળ આ સમુદાયના લોકોના ઘર-પરિવારોનો સર્વે કરીને કોને કઈ સુવિધાની જરૂર છે, અને ક્યાં કેટલો ગેપ રહેલો છે, તે શોધીને કરવામાં આવ્યા છે, અને તે મુજબ પાડવામાં આવી રહી છે.

સિદ્દી અને કોલઘા જૂથોનો સમાવેશ જનમન હેઠળ PVTG સમુદાયો માટે કાર્ય પ્રગતિમાં છે.

દ્વારા ૧૨,૪૮૯ આવાસોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. રોડ નેટવર્કની વાત કરીએ તો આ મિશન મોબાઇલ પીએમ જનમન મિશન હેઠળ હેઠળ ૧૭ રોડ-રસ્તાઓની કનેક્ટિવિટી મંજૂર કરવામાં આવી છે. જેટલા પાર્સલ લઇને આ ઉપરાંત, રાજ્યમાં વસતા આ સમુદાયના લગભગ ૨૮૦૩ ઘરોમાં પાઇપલાઇન મારફતે પાણીની જરૂર હતી, અને આ તમામ એટલે કે ૧૦૦% ઘરોમાં પાઈપ મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું છે. આ સમુદાયોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે ૨૨ મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. પીએમ જનમન મિશન હેઠળ, આંગણવાડીઓ કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે, જ્યારે શિક્ષણના હેતુથી ૧૩ હોસ્ટેલોના નિર્માણની મંજૂરી

આપવામાં આવી છે. આ મિશન હેઠળ, વીજળી નહોતી પહોંચતી એવા ૫૨૦૦ ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી ગુજરાતમાં આવા ૫ ખાસ નબળા તેમને પાયાની સુવિધાઓ પૂરી છે, તેમજ ૩૭ મોબાઈલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે. વધુ ૩૪ ગુજરાત રાજ્યમાં પીએમ મોબાઈલ ટાવરો સ્થાપિત કરવાનું

આઈસીઆઈસીઆઈ બેંક લીમીટેડ

## ગ્રામીણ નાણાકીય સશક્તીકરણમાં એક ઐતિહાસિક સીમાચિક્ત, મહિલા સ્વ-સહાય જૂથોને ૧૧ લાખ કરોડથી વધુ લોનનું વિતરણ

પી.આઇ.બી. અમદાવાદ

દીનદયાળ અંત્યોદય યોજના -રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ એક મહત્વપૂર્ણ સીમાચિક્ષ પ્રાપ્ત થયું છે. ઔપચારિક નાણાકીય સંસ્થાઓ દ્વારા મહિલા સ્વ-સહાય જૂથો (SHG)ને ૧૧ લાખ કરોડથી વધુની લોનનું વિતરણ કરવામાં

બેંકિંગ સમુદાયના સમર્થનથી પ્રાપ્ત થયેલી આ ઐતિહાસિક સિદ્ધિ, સરકારની પાયાના સ્તરે સમાવેશી સિદ્ધિ બેંકિંગ ભાગીદારો વિના વિકાસ, મહિલા સશક્તીકરણ અને શક્ય ન હોત. બેંકિંગ ભાગીદારી

આપવાની પ્રતિબિંબિત કરે છે.

NRLM અને લખપતિ દીદી છે. યોજના જેવી પહેલ દ્વારા લાખો મહિલાઓને સશક્ત બનાવ્યા છે. ૯૮%થી વધુના ઉચ્ચ બિન-ચૂકવણી દર (NPA) સાથે ૧૧ લાખ મજબૂત સમુદાય સંસ્થાઓમાં કરોડનું વિતરણ આ કાર્યક્રમની સંગઠિત કરીને સફળતાનો પુરાવો છે.

મિશન હેઠળ આ નોંધપાત્ર બનાવવાનો છે.

નાણાકીય મજબૂતાઈને પ્રોત્સાહન મજબૂત રહી, જેણે સ્વ-સહાય જૂથ સહાય તરફ કામ કરીને, સ્વ-સહાય ઍક્સેસ અને પ્રક્રિયાઓનું પ્રતિબદ્ધતાને ચળવળને મજબૂત બનાવી અને ગ્રામીણ મહિલાઓને સ્વનિર્ભરતા સ્વ-સહાય જૂથ ચળવળે DAY- સાથે આગળ વધવા માટે પ્રેરિત કરી

> પૃષ્ઠભૂમિ: ગ્રામીણ ગરીબ મહિલાઓને આજીવિકાના આધારને મજબૂત

> કોલેટરલ-મુક્ત લોન, વ્યાજ સબસિડી અને અન્ય નાણાકીય

જૂથોએ ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણ સરળીકરણ પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સેવા આપી છે. આ સતત ધિરાણ પ્રવાહે ગ્રામીણ મહિલાઓને ઉદ્યોગસાહસિકતા DAY-NRLMનો મૂળ ઉદ્દેશ્ય તરફ આગળ વધવા માટે પ્રેરિત કરી

મુખ્ય યોગદાનઃ

પ્રાથમિકતા ક્ષેત્ર ધિરાણ હેઠળ નાણાકીય સેવાઓ પૂરી પાડવી

બેંક સખીઓ

વ્યવહારો, દસ્તાવેજીકરણ અને લોન અરજીમાં સહાય પરી પાડવી વીમા, પેન્શન જેવી યોજનાઓ પર નાણાકીય સાક્ષરતા અને

માહિતી પૂરી પાડવી બેંક ખાતાઓ માટે આધાર અને મોબાઇલ સીડીંગમાં સહાય

સમયસર લોન ચકવણી SHG ને લોન અને અન્ય સુનિશ્ચિત કરવા માટે સમુદાય આધારિત પુનઃપ્રાપ્તિ પદ્ધતિ SHG સભ્યો માટે સરળ લોન (CBRM) ને મજબૂત બનાવવી.

# ફોનનું પાર્સલ પોલીસે શોધી આપ્યું

મણીનગરમાં રહેતા ડીલર મોબાઇલ ફોનના છ બાવળામાં આવેલા એ મેઝાેનના વેરહાઉસમાં આપવા માટે જતા હતા. ત્યારે ઉજાલા સર્કલ પાસે પહોંચતા ૨૦ મોબઇલ ફોન ભરેલું એક પાર્સલ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે સરખેજ પોલીસને જાણ

આધારે ગણતરીના સમયમાં શોધીને પરત અપાવ્યું હતું. મણિનગરમાં રહેતા મીરજભાઇ પંચાલ આશ્રમ રોડ પર આવેલી તેમની ઓફિસથી મોબાઇલ ફોનના છ પાર્સલ લઇને બાવળામાં આવેલા એમેઝોનના વેરહાઉસ પર આપવા માટે રીક્ષામાં જતા ત્યારે ઉજાલા સર્કલ પાસે પહોચતા જોયુ તો ૨૦ મોબાઇલ ફોન ભરેલું એક પાર્સલ ઓછુ હતુ. જેથી તપાસ કરી હતી. પરંતુ, કોઇ કડી

કરતા પોલીસે સીસીટીવી ફ્રુટેજના પોલીસને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ધુળિયાએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરાવી હતી. જેમા જોવા મળ્યું હતું કે સરખેજ ઢાળ પાસે બમ્પ આવતા પાર્સલ નીચે પડી ગયું હતુ. જે એક વ્યક્તિ લઇને જતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે તપાસ કરીને પાર્સલ લઇને જનાર રફ્રીક મનસુરી (રહે. આફરીન પાર્ક, ફતેવાડી) ની ભાળ મેળવી હતી અને જાણવા મળ્યું હતું કે તે પોલીસ સ્ટેશનમાં પાર્સલ જમા મળી નહોતી. જેથી આ અંગે સરખેજ કરાવવા માટે આવી રહ્યા હતા.

## રીક્ષામાંથી ગુમ થયેલુ ૨૦ મોબાઇલ ઇન્ડિયાસ્કિલ્સ ૨૦૨૫ માટે નોંધણી શરૂઃ દેશની ટોચની પ્રતિભાઓની શોધ શરૂ માટે સૌથી મોટી આંતરરાષ્ટ્રીય દ્વારા આયોજિત રાજ્ય-સ્તરીય

પી.આઇ.બી. અમદાવાદ

વ્યવસાયિક તાલીમ અને કૌશલ્ય વિકાસમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરતું દેશનું મુખ્ય પ્લેટફોર્મ, ઇન્ડિયાસ્કિલ્સ કોમ્પિટિશન (ISC) 2025 માટે નોંધણી શરૂ થતાં જ મંચ તૈયાર થઈ ગયો છે અને બધાની નજર ભારતની આગામી પેઢીના કૌશલ્ય ચેમ્પિયન પર છે. ભારત સરકારના કૌશલ્ય મંત્રાલય (MSDE) એ આજે ISC 2025 માટે નોંધણી લિંક ખોલી છે. આ સ્પર્ધામાં ૬૩ કૌશલ્યો હશે જેના માટે તમામ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહભાગીઓ ભાગ લેશે. નોંધણી સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ (SIDH) પોર્ટલ દ્વારા ઑનલાઇન પૂર્ણ કરી શકાય છે. નોંધણી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ છે.

આ દ્વિવાર્ષિક સ્પર્ધા ભારતના સૌથી પ્રતિભાશાળી યુવાનોને ઓળખવા તેમને ઉછેરવા અને પુરસ્કાર આપવા માટે બનાવવામાં આવી છે. જેથી તેઓ વર્લ્ડસ્કિલ્સ કોમ્પિટિશન (WSC) 2026 જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર થઈ શકે. તે વિશ્વના યુવા વ્યાવસાયિકો

કૌશલ્ય સ્પર્ધા છે, જે ૬૦થી વધુ કૌશલ્યોમાં યુવાનોની કુશળતા દર્શાવે છે. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય યુવાનોને વ્યાવસાયિક શિક્ષણમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપવાનો અને આજના અર્થતંત્રમાં કુશળ કાર્યના મહત્વને ઓળખવાનો છે.

વિકાસ અને ઉદ્યોગસાહસિકતા નાગરિકો માટે ખુલ્લી છે અને સહભાગીઓએ ચોક્કસ વય આધારિત કુશળતા બંનેનો સમાવેશ માપદંડોને પૂર્ણ કરવા જરૂરી છે. લઘુત્તમ ઉંમર ૧૬ વર્ષ અને મહત્તમ ઉંમર ૨૫ વર્ષ છે. સામાન્ય રીતે સહભાગીઓનો જન્મ ૧ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ અથવા તે પછી થયો હોવો જોઈએ. સાયબર સુરક્ષા, મેકાટ્રોનિક્સ, એરક્રાફ્ટ જાળવણી વગેરે જેવી ચોક્કસ અઘતન તકનીકી કુશળતા માટે, સહભાગીઓનો જન્મ ૧ જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ અથવા સ્પર્ધાના વિજેતાઓને વર્લ્ડસ્કિલ્સ તે પછી થયો હોવો જોઈએ.

સંરચિત, બહુ-તબક્કાની પસંદગી પ્રતિનિધિત્વ કરવા માટે વ્યાપક પ્રક્રિયાને અનુસરે છે. દરેક સહભાગી ફક્ત એક જ કુશળતા માટે અરજી કરી શકે છે. સ્પર્ધા બે મુખ્ય ટ્રેકમાં આયોજિત થાય છે. ટ્રેક Iમાં રાજ્ય કૌશલ્ય વિકાસ મિશન (SSDM)

સ્પર્ધાઓ સામેલ છે, જ્યારે ટ્રેક IIનું નેતૃત્વ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (SSC) દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પસંદ ન કરાયેલ કુશળતા માટે કરવામાં આવે છે. બંને ટ્રેકમાં પ્રાદેશિક કૌશલ્ય સ્પર્ધાઓ (RSCs) ત્યારબાદ બુટ કેમ્પ અને અંતિમ આ સ્પર્ધા બધા ભારતીય રાષ્ટ્રીય સ્પર્ધાનો સમાવેશ થશે. આ સ્પર્ધામાં વ્યક્તિગત અને ટીમ-થાય છે, જે વર્લ્ડસ્કિલ્સ ઇન્ટરનેશનલ દ્વારા નિર્ધારિત શ્રેણીઓ સાથે નજીકથી સંરેખિત છે.

પ્રાદેશિક સ્પર્ધાઓ પાંચ પ્રદેશોમાં યોજાશે - ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ - જયારે અંતિમ ઇન્ડિયાસ્કિલ્સ રાષ્ટ્રીય સ્પર્ધા MSDE દ્વારા કેન્દ્રીય રીતે આયોજિત કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્પર્ધા ૨૦૨૬ અને અન્ય ઇન્ડિયાસ્કિલ્સ ૨૦૨૫ એક આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે.

> માહિતી વધુ www.skillindiadigital.gov.in

### <u>ભૌતિક</u> કબ્જા નોટીસ

<sub>ધ્રા</sub>ન્ચ ઓફિસઃ આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ.,ઓફિસનં ૨૦૧-બી, બીજે માળ,

**FICICI Bank** રોડનં ૧ પ્લોટ નં- બી ૩ વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઈન્ડસ્ટીયલ એસ્ટેટ,થાણે, (વેસ્ટ)-૪૦૦૬૦૪ સિક્યુરાઇઝેશન રિકંસ્ટ્રક્શન ફાઇનાન્સ એસેટ એન્ડ ઇનફોર્મ્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઓફ ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સિક્યુરિટી ઇન્ટરેસ્ટ ઇન્ફોર્સમેન્ટ ૨૦૦૨ની કલમ ૧૩ (૧૨) તેની સાથે અનચ્છેદ ૩ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ (દીવાન હાઉસિંગ ફાયનાન્સ લી. દ્વારા આઈસીઆઈસીઆઈના નિમાયેલા નીચે સહી કરનાર અધિકારીએ ) સિક્યોરિટી ઓફ એન્ફોર્સમેન્ટ ના સંબંધમાં ડીએચએફએલ અને કરજદારો વચ્ચે લોન બાબતે થયેલા કરારના આધારે હાઉસિંગ લોન ની સગવડ મેળવી છે, તેઓ જે લોન મેળવી છે, તેની મૂળ રકમ અને વ્યાજની ચુકવર્શીમાં તેઓ નિષ્ફળ ગયા છે , તેથી આ નોટીસ આપ્યાથી ૬૦ દિવસની અંદર અહી દર્શાવેલા નાણા ભરી જવા જણાવવામાં આવે છે. કરજદારો નાણા ચૂકવવામાં નિષ્ફળ ગયા છે. આથી કરજદારો અને સામાન્ય જનતાની જાણ માટે નીચે જણાવેલા અધિકારીએ અહી જણાવેલી મિલ્કતના કબ્જો લઈ લીધો છે જે કલમ ૧૩ (૪) અનુચ્છેદ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ કાર્યવાહી કરી છે. કરજદારો અને સામાન્ય જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે આઈસીઆઈસીઆઈ બેંક લીમીટેડ પાસે આ મિલ્કત ટાંચમાં હોય કરજદારો અને સામાન્ય જનતાએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં.

ક્રમ નં.	કરજદારો સહ-કરજદારો નું નામ / (ડીએચએફએલ જુનો લેન અને આઈસીઆઈસીઆઈ નવો લેન)	મિલ્કતની વિગત / કબ્જાની તારીખ	ડિમાંડ નોટીસની તારીખ / ડિમાંડ નોટીસની ૨કમ (૨ૂ)	શાખાનું નામ
٩.	હાર્દિક ભરતભાઈ સોલંકી/પુજાબેન હાર્દિકભાઈ સોલંકી, ન્યુ આઈસીઆઈસીઆઈ લેન નં. QZSUR00005013410- જુનો ડિએચએકએલ લેન નં. ૦૪૧૦૦૦૦૮૫૫૧	ર દે જલાઈ ૨૦૨૫	૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ રૂા. ૧૨,૧૭,૧૦૦.૭૬/-	સુરત
	જગારામ એન જાટ/જમુદેવી જગદીશકુમાર જાટ- ન્યુ આઈસીઆઈસીઆઈ લેન નં. QZBRD00005019465- જુનો ડિએચએફએલ લેનનં. ૦૧૮૦૦૦૦૮૦૫૯	સ્વામી રેસીડેન્સી સામે, કિમ મેઇન રોડ, સ્વામી નારાયણ ટેમ્પલ સામે, કડસદ. રામનગર બ્લોક નં. ૭૯૯. પ્લોટ નં. ૨૧.૨૨. ૨૩.૨૪. ૨૫.	૧૩ જુલાઈ, ૨૦૨૨ રૂા. ૧૩,૬૦,૧૧૭.૦૦/-	સુરત

ઉપર જણાવેલા કરજદાર(રો)/ જામીનદાર(રો) અહી બાકી નાણાં પરત કરી જવા માટે ૩૦ દિવસની નોટીસ આપવામાં આવે છે. નહીં તો કલમ ૮ અને ૯ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (ઇન્ફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ની જોગવાઈ મુજબ જામીન તરીકે મુકેલી મિલ્કત આ નોટીસ પ્રસિદ્ધ થયાનાં ૩૦ દિવસ બાદ વેચી દેવામાં આવશે. ઓથોરાઈઝડ ઓફિસર,

આઈબીએલ ફાઇનાન્સ લિમિટેડ

### CIN:L65999GJ2017PLC098565

રજિસ્ટર્ડ ઓફિસઃ દુકાન-૧૫૧, સિલ્વર સ્ટોન આર્કેડ, નજીક કંથેરિયા હનુમાન મંદિર, ઓપી-૩૪/એબીસીડી, એફપી-૫૦, સિંગણપોર-કોઝવે રોડ, સુરત, ગુજરાત, ભારત, ૩૯૫૦૦૪ વેબસાઈટઃ www. www.iblfinance.in; ઇમેઇલઃ compliance@iblfinance.in; કોન નં. : +91 9328116900

કંપનીની ૮ મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ, બુક કલોઝર / કટ ઓફ ડેટ અને ઇ-મતદાનની નોટિસ નોટિસ દારા જાણ કરવામાં આવે છે કે, કોર્પોરેટ બાબતો માટેના મંત્રાલય (Ministry of Corpo®ae Affairs) દ્વારા જાહેર કરાયેલ જનરલ પરિપત્ર નંબર ૦૯, ૨૦૨૪ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ અને અગાઉના પરિપત્રો (જેને હવે 'MCA પરિપત્રો' તરીકે ઓળખવામાં આવે છે) અનુસાર, કંપનીની ૮મી વાર્ષિં સામાન્ય સભા ("AGM") શુક્રવાર, ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બપોરે ૪:૦૦ વાગ્યે (IST) વિડિયો કોન્ફરન્સ (VC) / અન્ય ઓડિઓ વિઝ્યુઅલ માધ્યમો

(OAVM) મારફતે યોજાશે જેમાં સામાન્ય તથા વિશિષ્ટ વિહિત કાર્યો હાથ ધરાશે. ઉપરોક્ત MCA પરિપત્રો અને SEBI ના તારીખ ૦૩ ઓક્ટોબર, ૨૦૨૪ના પરિપત્રના અનુસંધાને, ૮મી AGM ની નોટિસ તેમજ ૨૦૨૪-૨૫ માટેનો વાર્ષિક અહેવાલ ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ફક્ત તે સભ્યોને મોકલવામાં આવી રહ્યો છે, જેમના ઈમેઇલ સરનામા શુક્રવાર, ૨૫ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં કંપની અથવા ડિપોઝિટરી સાથે નોંધાયેલ છે. AGM ની નોટિસ અને વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫ કંપનીની વેબસાઈટ www.iblfinance.in, NSE ની વેબસાઈટ

www.nseindia.com અને NSDL ની વેબસાઈટ www.evOing.nsdl.com પર અપલોડ કરવામાં આવ્યા છે. જેમના ઈમેઇલ સરનામા નોંધાયેલા નથી તેઓ AGM ની નોટિસ અને વાર્ષિક અહેવાલ મેળવી શકે તે માટે AGM નોટિસમાં આપેલી રીત પ્રમાણે ઈમેઇલ નોંધણી કરી શકે છે. સફળતાપૂર્વક ઈમેઇલ નોંધાવ્યા બાદ, એવા સભ્યોને AGM ની નોટિસ, વાર્ષિક અહેવાલ અને ઈ-વોટિંગ માટે યુઝર ID અને પાસવર્ડ મોકલવામાં આવશે. કોઈપણ પ્રશ્ન માટે compliance@iblfinance.in પર ઈમેઇલ કરીને સંપર્ક કરી શકાય છે. જેમના શેર ડિમેટ ફોર્મમાં છે તેઓએ પોતાનું સંપૂર્ણ માહિતી તથા ઈમેઇલ ડિટેલ્સ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે અપડેટ કરવું જરૂરી છે.

કંપનીના સભ્યોનું રજીસ્ટર તથા શેર ટ્રાન્સફર બુક શનિવાર, ૧૬ ઓગસ્ટ, ૨૦૨૫થી શુક્રવાર, ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી બંધ રહેશે. જેમના નામો શુક્રવાર, ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર કે ડિપોઝિટરીના રજીસ્ટરમાં હશે, તેઓ રિમોટ ઈ-વોટિંગ અને AGMના દિવસે ઈ-વોટિંગ કરવાની લોયક રહેશે. Section 108 of Companies Act, 2013 અને SEBI (LODR) નિયમાવલીઓ અનુસાર, NSDL દ્વારા ઈ-વોટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રિમોટ ઈ-વોટિંગ શરૂ થશેઃ મંગળવાર, ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ - સવારે ૯ઃ૦૦ વાગ્યે અંતઃ ગુરુવાર, ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ - સાંજે પઃ૦૦ વાગ્યે .

મહત્વપૂર્ણ નોંધઃ એ) તે પછી રિમોટ ઈ-વોટિંગ બંધ કરવામાં આવશે અને મત બદલી શકાય નહીં.

બી) AGMના દિવસે પણ ઈ-વોટિંગ ઉપલબ્ધ રહેશે.

સ્થળઃ સુરત

સી) જેમણે પહેલેથી મત આપી દીધો છે, તેઓ છય્સ્માં હાજરી આપી શકે છે પણ ફરીથી મત આપી શકશે નહીં.

જેમણે છય્સ્નોટિસ પછી શેર ખરીદ્યા છે અને ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ શેરહોલ્ડર બન્યા છે, તેઓ evoting@nsdl.co.in અથવા cor પર ઈમેઇલ કરીને લૉગિન ડીટેલ્સ મેળવી શકે છે. જો તમે NSDL સાથે પહેલેથી નોંધાયેલ છો તો હાલની લોગિન માહિતી ઉપયોગ કરી શકો છો. પાસવર્ડ ભૂલી ગયા હોય તો www.evoting.nsdl.com. પર "Forgot Password" વિકલ્પ ઉપયોગ કરો. SEBI પરિપત્ર (તારીખઃ ૯ ડિસેમ્બર, ૨૦૨૦) અનુસાર ડિમેટ હોલ્ડસં તેમના ડિપોઝિટરી એકાઉન્ટમાંથી પણ સીધા મત આપી શકે છે. ખાતામાં યોગ્ય મોબાઇલ નંબર અને ઈમેઇલ ID અપડેટ કરવી અનિવાર્ય છે. કોઈ પણ વધુ માહિતી માટે, શ્રી દિલીપભાઈ ચૌહાણ, કંપની સેક્રેટરી અને કોમ્પ્લાયન્સ ઓફિસર, સાથે રજીસ્ટર્ડ ઓફિસ પર અથવા compliance@iblfin

પર ઈમેઇલ કરીને અથવા +91 93281 16900 પર સંપર્ક કરી શકાય છે. AGM ફક્ત VC/OAVM માધ્યમ દ્વારા યોજાશે. AGMમાં જોડાવા માટેની સૂચનાઓ AGM નોટિસમાં આપવામાં આવી છે.

જો AGMમાં જોડાવા માટે કોઈ પ્રશ્ન કે મુશ્કેલી હોય, તો ev0ing@nsdl.co.in પર ઈમેઇલ કરો અથવા ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ / ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ પર ફોન્ કરો. VC/OAVM દ્વારા જોડાયેલ સભ્યો Companies Act, 2013 ની કલમ ૧૦૩ અનુસાર ક્ચોરમ માટે ગણવામાં આવશે.

સ્થળઃ સુરત

તારીખઃ ૩૦ જુલાઈ, ૨૦૨૫

દિલીપભાઈ ચૌહાણ કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર

આઈબીએલ ફાઈનાન્સ લિમિટેડ વતી,

## કેન્દ્રીય રેલવે મંત્રીએ વડોદરામાં સાવલી ખાતે અલ્સ્ટોમના પ્લાન્ટ કામગીરીની સમીક્ષા કરી અને તેની જાળવણી પ્રથાઓનું કેન્દ્રિત મૂલ્યાંકન કર્યું

પી.આઇ.બી. અમદાવાદ

લીધી, ગુજરાત, ભારતમાં રેલવે રોલિંગ સ્ટોક માટે મુખ્ય ઉત્પાદન કેન્દ્ર છે. તેમણે સાવલી સુવિધા ખાતે અલ્સ્ટોમના સંચાલનની સમીક્ષા કરી, જેમાં જાળવણી પ્રથાઓનું કેન્દ્રિત મલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમણે દરેક ઓર્ડર માટે કસ્ટમાઇઝુડ સોલ્યુશન્સ ડિઝાઇન કરવાની અલ્સ્ટોમની પ્રથાની પ્રશંસા કરી - એક નવીનતા જે ભારતીય રેલવે અનુકરણ કરી શકે છે - અને રચનાત્મક અને સહયોગી માળખા દ્વારા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય સાથે સંયુક્ત તાલીમ કાર્યક્રમ વિકસાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમણે એવું પણ સૂચન કર્યું કે તમામ પીયુના જનરલ મેનેજરો અલ્સ્ટોમના સાવલી યુનિટની તાલીમ અને એક્સપોઝર મુલાકાતો લે. ચર્ચાઓમાં નિવારક જાળવણી માટે સેન્સર અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા બાબત પણ સામેલ હતી. સાવલી સુવિધા ભારત સરકારના મેક ઇન નિકાસ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે, અત્યાધુનિક કોમ્યુટર અને ટ્રાન્ઝિટ ટ્રેન કારનું ઉત્પાદન કરી રહી છે. નવીનતા અને ઉત્પાદન શ્રેષ્ઠતા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને, ભારતના ૩,૪૦૦થી વધુ ઇજનેરો છે પેસેન્જર કોચઃ મોઝામ્બિક, વિશ્વભરમાં ૨૧ અલ્સ્ટોમ સાઇટ્સ સાથે સક્રિયપણે સહયોગ કરી રહ્યા છે. ૨૦૧૬થી, ભારતે વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ માટે ૧,૦૦૨ રેલ કારની સફળતાપૂર્વક સિસ્ટમ્સના વિશ્વસનીય સપ્લાયર તરીકે દેશની સ્થિતિને મજબૂત બનાવે છે. સાવલી ખાતે ૪૫૦ રેલ કારનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું અને

મહત્વપૂર્શ રેલ ઘટકોની નિકાસ સાવલી યુનિટે જર્મની, ઇજિપ્ત,

ક્વીન્સલેન્ડ મેટ્રો પ્રોજેક્ટ માટે

ઓસ્ટ્રેલિયામાં નિકાસ કરવામાં આવી

સ્વીડન, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની સહિતના દેશોમાં ૩,૮૦૦થી વધુ વૈષ્ણવે વડોદરામાં સાવલી ખાતે બોગી સફળતાપૂર્વક નિકાસ કરી છે, અલ્સ્ટોમના પ્લાન્ટની મુલાકાત સાથે વિયેના, ઑસ્ટ્રિયામાં પૂરા પાડવામાં આવેલા ૪,૦૦૦થી વધ ફ્લેટપેક (મોડ્યુલ્સ) પણ છે. માનેજા યુનિટે વિવિધ વૈશ્વિક પ્રોજેક્ટસમાં ૫,૦૦૦થી વધુ પ્રોપલ્શન સિસ્ટમ્સ નિકાસ કરીને નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ભારતમાં ડિઝાઇન, ઘણા દેશોમાં ઇન્સ્ટોલઃ ભારત હાલમાં ૨૭ આંતરરાષ્ટ્રીય સિગ્નલિંગ પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરી રહ્યું છે અને વિશ્વભરમાં વધારાના ૪૦ પ્રોજેક્ટ્સ માટે સપોર્ટ પૂરો પાડી રહ્યું છે. બેંગ્લોરનું ડિજિટલ એક્સપિરિયન્સ સેન્ટર IoT, AI, બ્લોકચેન અને સાયબર સુરક્ષાનો ઉપયોગ કરીને આગામી પેઢીના સિગ્નલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વભરમાં ૧૨૦+ પ્રોજેક્ટસને સપોર્ટ કરીને નવીનતા ચલાવી રહ્યં છે. "ડિઝાઇન, વિકાસ અને ભારતથી દુનિયા સુધી પહોંચાડવા"ના વિઝનના ભાગ રૂપે ભારતના રેલ ઉત્પાદનોની નિકાસમાં વધારો

મેટ્રો કોચઃ ઓસ્ટ્રેલિયા, કેનેડામાં

બોગીઃ યુકે, સાઉદી અરેબિયા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયામાં મોકલવામાં આવે છે

પ્રોપલ્શન સિસ્ટમ્સઃ ફ્રાન્સ મેક્સિકો, રોમાનિયા, સ્પેન, જર્મની અને ઇટાલીમાં પુરા પાડવામાં આવે બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પહોંચાડવામાં આવે છે

લો કો મો ટિવ્સઃ મો ઝામ્બિક, સેનેગલ, શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ અને ગિની રિપબ્લિકમાં નિકાસ કરી છે, જે આધુનિક રેલ નિકાસ કરવામાં આવે છે સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપોઅગ્રણી સપ્લાયર્સનું મજબૂત નેટવર્ક સાવલી નજીક ઉત્પાદન ઇકોસિસ્ટમને ટેકો આપે છે. અગ્રણી ખેલાડીઓમાં ઇન્ટિગ્રા, એનોવી, હિંદ રેક્ટિફાયર, હિટાચી એનર્જી અને એબીબીનો સમાવેશ થાય છે, જે ફેબ્રિકેશન, ઇન્ટિરિયર્સ અને ઇલેક્ટ્રિકલ

સિસ્ટમ્સમાં નિષ્ણાત છે.

### કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) એ ઓર્ગેનિક કોર્ટન સર્ટિફિકેશનમાં પાયાવિહોણા આરોપોનું ખંડન કર્યું નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન (NPOP) હેઠળ ઓર્ગેનિક સર્ટિફિકેશનમાં તૃતીય-પક્ષ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે,

યરોપિયન કમિશન અને સ્વિટઝર્લેન્ડ દ્વારા પાક સ્તરે માન્યતા પ્રાપ્ત છેઃ APEDA

પી.આઇ.બી. અમદાવાદ

ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય, વાણિજય વિભાગ દ્વારા ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ માટે શરૂ કરવામાં આવ્યું હતું અને APEDA NPOP ના અમલીકરણ માટે સચિવાલય તરીકે કાર્ય કરે છે. ઉત્પાદક જથ પ્રમાણન પ્રણાલી ૨૦૦૫માં રજૂ કરવામાં આવી હતી કારણ કે તે નાના અને સીમાંત ખેડુતોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે જરૂરી લાગ્યું હતું.

ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ માટે તૃતીય પક્ષ પ્રમાણપત્ર ફરજિયાત છે. પાક ઉત્પાદન માટેના NPOP ધોરણોને યુરોપિયન કમિશન અને સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા સ્થાનિક ધોરણોની સમકક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે અને ગ્રેટ બ્રિટન દ્વારા પણ સ્વીકારવામાં આવ્યા છે. તાઇવાન સાથે ઓર્ગેનિક ઉત્પાદનો માટે MRA

NPOP હેઠળ ઓર્ગેનિક સર્ટિફિકેશન સિસ્ટમમાં ઓર્ગેનિક પ્રક્રિયાઓ અને ઓર્ગેનિક ઉત્પાદનો માટે તૃતીય પક્ષ પ્રમાણપત્ર પ્રણાલીનો સમાવેશ થાય છે. તે સપ્લાય ચેઇનમાં પ્રમાણપત્ર સંસ્થા (સરકારી અથવા ખાનગી) દ્વારા પ્રમાણિત છે. માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર સંસ્થાઓ તેમના માન્યતાના અવકાશ મુજબ ઓર્ગેનિક ઓપરેટરોને પ્રમાણિત કરે છે. હાલમાં, ભારતમાં ૩૭ પ્રમાણપત્ર સંસ્થાઓ કાર્યરત છે જેમાં ૧૪ રાજ્ય પ્રમાણપત્ર સંસ્થાઓનો સમાવેશ થાય શકે છે.

APEDA અથવા વાશિજય વિભાગ NPOP હેઠળ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને કોઈ સબસિડી આપતું નથી. પ્રતિ હેક્ટર રૂ. ૫૦,૦૦૦ નો આંકડો અને અન્ય ખોટી ગણતરીઓ પાયાવિહોણી છે. NPOP હેઠળ ઓર્ગેનિક સર્ટિફિકેશન ફક્ત મધ્યપ્રદેશ પૂરતું મર્યાદિત નથી પરંતુ તે ૩૧ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં

નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક ઓર્ગેનિક ઉત્પાદક જૂથો છે. આ કિસ્સાઓ બન્યા છે. આવા બિન-પ્રોડક્શન (NPOP) 2001 માં જૂથોમાં લગભગ ૧૯,૨૯,૨૪૩ અનુપાલન ફક્ત ભારત અથવા ખેડૂતો શામેલ છે. આ ઉત્પાદક જુથો માત્ર કપાસ જ નહી પરંતુ અનાજ, મસાલાનું ઉત્પાદન પણ કરે છે.

> આમ, વિગતોમાં ઉલ્લેખિત ઓર્ગેનિક ઉત્પાદક જૂથોની સંખ્યા તેમજ ખેડુતોની સંખ્યા ખોટી છે. એવું માનવું પણ ગેરમાર્ગે દોરનારું છે કે ભારતના બધા ઓર્ગેનિક ઉત્પાદક કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં જુથો મધ્યપ્રદેશમાં સ્થિત છે અને ફક્ત 🛮 આવ્યા છે . કપાસનું ઉત્પાદન કરે છે.

છે કે કપાસ NPOP હેઠળ ફક્ત ઉત્પાદન તબક્કા સુધી જ આવરી લેવામાં આવે છે. ત્યારબાદ, જીનિંગ, પ્રોસેસિંગ વગેરે સહિત ઉત્પાદન પછીની કામગીરી ખાનગી પ્રમાણપત્ર હેઠળ હાથ ધરવામાં આવે છે.

NPOP હેઠળ, ICS પોતે અથવા સેવા પ્રદાતા/મેન્ડેટર દ્વારા પ્રમાણપત્ર માટે વધારાના નિરીક્ષણો સંચાલિત કરી શકાય છે. NPOP માટે નવી પ્રક્રિયાઓ અમલમાં ધોરણો મુજબ, ICS માટે વર્ષમાં બે મુકવામાં આવી છે. આ પ્રક્રિયામાં, વાર બધા ખેડૂતોનું આંતરિક નિરીક્ષણ કરવું ફરજિયાત છે. વધુમાં, પ્રમાણન સંસ્થા (CB) દરેક ICSનું વાર્ષિક ઓડિટ કરે છે જેમાં નમૂના યોજનાના આધારે ઓફિસ ઓડિટ અને ફાર્મ શકે. ઓડિટનો સમાવેશ થાય છે. નમૂના યોજના મુખ્યત્વે હોલ્ડિંગના કદ, મુલ્યાંકન પર આધારિત છે.

સ્તરની તપાસ કરવામાં આવે છે, જેમાં ઉત્પાદક જૂથો (ICs) સહિત સ્વરૂપમાં પ્રાપ્ત જોખમ મૃલ્યાંકન/ ફરિયાદોના આધારે કરવામાં આવે છે. આ ઓડિટ NAB દ્વારા રચાયેલી અને APEDA દ્વારા સંકલિત

NPOP હેઠળ ૪૭૧૨ સક્રિય ગેરરીતિઓ અને દુરુપયોગના NPOP પુરતા મર્યાદિત નથી પરંતુ કોઈપણ નિયમનકારી પ્રણાલીમાં કઠોળ, તેલીબિયાં, ચાં, કોફી, થાય છે. આ સંદર્ભમાં, અધિકારીઓ દ્વારા નીચેની કાર્યવાહી કરવામાં આવી છેઃ

NPOP ધોરણોના ઇરાદાપૂર્વક ઉલ્લંઘન અને પ્રમાણપત્ર સંસ્થાઓ દ્વારા ગંભીર બિન-અનુપાલનના

ઉત્પાદક જૂથોની કાનૂની અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ એન્ટિટીના સંદર્ભમાં વધુ કડક ધોરણો લાવવા, ઉત્પાદક જૂથની નજીકમાં ICS ઓફિસ દ્વારા કડક દેખરેખ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઉત્પાદક જૂથોનું નિરીક્ષણ કરવા માટે NPOP નિયમોમાં સુધારો કરવામાં આવ્યો

> ઓર્ગેનિક કપાસ ઉત્પાદનના કપાસને પ્રમાણિત કરતી પ્રમાણપત્ર એજન્સીઓનો અવકાશ પણ મર્યાદિત કરવામાં આવ્યો છે જેથી તેઓ વધુ નજીકથી દેખરેખ અને નિરીક્ષણ કરી

અઘોષિત નિરીક્ષણો અનેકગણા વધી ગયા છે. ઉત્પાદક જૂથો અને ICS માં ખેડૂતોની સંખ્યા અને જોખમ પ્રમાણપત્રમાં ડિફ્રોલ્ટ કરનારા સંસ્થાઓ સામે કડક પગલાં લેવામાં પ્રમાણપત્ર સંસ્થાઓ જરૂરિયાત આવ્યા છે. APEDA એ ખાતરી મુજબ વધારાના નિરીક્ષણો પણ કરી કરવા માટે પ્રતિબદ્ધ છે કે NPOP હેઠળ કાર્બનિક પ્રમાણપત્ર પ્રણાલી ઉપરોક્ત ઉપરાંત, NAB દ્વારા વિશ્વસનીય, પારદર્શક અને ન્યાયી અહી સ્પષ્ટ કરવામાં આવે છે કે APEDA દ્વારા CBs પર ત્રીજા છે. જ્યાં પણ કાર્બનિક ધોરણોનું પાલન ન કરવાના/ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવાના વિશ્વસનીય પુરાવા ઓપરેટરોના અઘોષિત ઓડિટના પ્રકાશમાં આવ્યા છે, APEDA એ વ્યાપક તપાસ હાથ ધરી છે અને નક્કર પગલાં લીધા છે. આવા તમામ કેસ કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસરીને યોગ્ય ચકાસણીને આધિન મુલ્યાંકન સમિતિ દ્વારા હાથ ધરવામાં છે. કોઈપણ પ્રમાણપત્ર સંસ્થા અથવા આવે છે. ઉપરોક્ત તપાસ અને ઓપરેટર ધોરણોનું ઉલ્લંઘન કરતા ફેલાયેલું છે. નવીનતમ રેકોર્ડ સંતુલન સિસ્ટમમાં હોવા છતાં, જોવા મળે છે તેને NPOP નિયમન